

January 24, 2025

To,
BSE Limited
Corporate Relationship Department
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400001.

BSE Scrip Code: **515085** ISIN: **INE298E01022** 

<u>Subject: Newspaper Advertisement of Standalone Unaudited Financial Results for the quarter and nine months</u> ended December 31, 2024.

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copies of newspaper advertisement of the Standalone Unaudited Financial Results of the Company for the quarter and nine months ended December 31, 2024 published in the following newspapers:

- 1. Financial Express (English Language) on Friday, January 24, 2025.
- 2. Financial Express (Gujarati Language) on Friday, January 24, 2025.

The above information is also available on the website of the Company at www.restile.com

You are requested to take the above information on your records and oblige.

Thanking you,

Yours faithfully,

For Restile Ceramics Limited

Palak Kumari

Company Secretary and Compliance Officer

Membership No. A69959

Encl: as above

#### RESTILE CERAMICS LIMITED

Regd. Office: 204, Sakar Complex, Opp. ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat - 390015, India. CIN: L26931GJ1986PLC102350

Branch Office: D.No.1-10-77, 5th Floor, Varun Towers, Opp. Hyderabad Public School, Begumpet, Hyderabad - 500 016.

E-mail: restile@accountscare.com, works@restile.com, Website: www.restile.com Ph. No. 9998219763

Authorized Officer,



REGIONAL OFFICE, LAL DARWAJA, AHMEDABAD-380 001

## APPENDIX-IV [Rule- 8(1)]

POSSESSION NOTICE (For Immovable Property) Whereas The undersigned being the authorized officer of the Central Bank of India Jamalpur Astodia, District Ahmedabad under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement Rules, 2002 issued a demand notice dated 17/08/2024 calling upon the borrowe Mr. Hiren Mukesh Bhai Joshi, Mrs. Joshi Hiren Bhumika (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 31,04,615.55 (In Words Rs. Thirty One Lakhs Four Thousand Six Hundred Fifteen and Fifty Five Paisa Only) with interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrowe and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this 21st day of January of the year 2025.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 31,04,615.55 (In Words Rs. Thirty One Lakhs Four Thousand Six Hundred Fifteen and Fifty Five Paisa Only) and interest thereon w.e.f 17/08/2024 plus other charges. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

'The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, n respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY Mortgage Of Property Flat No A-20 A Block (As per approved Plan Block C), Fourth Floor, having 112.04 Sq. Meters Super Built up area along with undivided share o land 42.41 sq. meters in Block / Survey No 665 P4 P Khata No 2670 in the scheme Known as Binali Shops and Residency, Kapadwang Road at village Kathlal, Taluka

Kathlal and Dist. Kheda, East: - Flat No A/19 West: - Lift, North: - Back side Road South: Society Road Between Block A and B. Date: 21-01-2025 Authorized Officer. Place: Ahmedabad Central Bank of India



REGIONAL OFFICE,

LAL DARWAJA, AHMEDABAD-380 001

#### APPENDIX-IV [Rule- 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The undersigned being the authorized officer of the Central Bank of India Jamalpur Astodia, District Ahmedabad under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement Rules, 2002 issued a demand notice dated 17/08/2024 calling upon the borrower Mr Laxminarayan Nandkishor Dayma, Mrs. Shardaben N Damya (Co-Borrower) to repa the amount mentioned in the notice being Rs. 31,91,232.41 (In Words Rs. Thirty One Lakh Ninety One Thousand Two Hundred Thirty Two and Forty One Paisa Only) will interest as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rule 2002 on this 21st day of January of the year 2025.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 31,91,232.41 (In Words Rs. Thirty One Lakh Ninety One Thousand Two Hundred Thirty Two and Forty One Paisa Only) and nterest thereon w.e.f. 17/08/2024 plus other charges. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act n respect of time available, to redeem the secured assets." DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Mortgage Of Property Flat No C-07, C Block (As per approved Plan Block B), Third Floor, having 112,04 Sq. Meters Super Built up area along with undivided share of land 42.41 sq. meters in Block / Survey No 665 P4 P Khata No 2670 in the scheme Known Rinali Shons and Residency Kanadwani Road at village Kathlal. Taluka Kathlal at Dist: Kheda East:- Flat No C/06, West:- Flat No C/08, North:- Back side Road, South Society Road And Passage Between Block C and D **Authorized Officer.** Date : 21-01-2025 Place: Kathlal

Central Bank of India

#### POSSESSION NOTICE (for immovable property)

## Whereas,

The undersigned being the Authorized Officer of SAMMAAN FINSERVE LIMITED (CIN:U65923DL2006PLC150632) (formerly known as INDIABULLS COMMERCIAL CREDIT LIMITED) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 22,10,2024 calling upon the Borrower(s) JAYSHREE PHARMACEUTICALS (THROUGH ITS PARTNERS), GAJJAR NIMESH VINODKUMAR ALIAS NIMESH VINODBHAI GAJJAR PARTNER JAYSHREE PHARMACEUTICALS, HIRAL NIMESH GAJJAR, SADHNA VINODKUMAR GAJJAR, VINODBHAI V GAJJAR ALIAS VINODBHAI VALLABHDAS GAJJAR PARTNER JAYSHREE PHARMACEUTICALS to repay the amount mentioned in the Notice being Rs. 1,64,68,958.24 (Rupees One Crore Sixty Four Lakhs Sixty Eight Thousand Nine Hundred Fifty Eight And Paise Twenty Four Only) against Loan Account No. HLLAAHE00537476 as on 16.10.2024 and interest thereon within 60 days from the date of receipt of the said Notice

The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 20.01.2025.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of SAMMAAN FINSERVE LIMITED (formerly known as INDIABULLS COMMERCIAL CREDIT LIMITED) for an amount of Rs. 1,64,68,958.24 (Rupees One Crore Sixty Four Lakhs Sixty Eight Thousand Nine Hundred Fifty Eight And Paise Twenty Four Only) as on 16.10.2024 and interest thereon.

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets

# DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

ALL THAT PIECE AND PARCEL OF LAND/PROPERTIES AS UNDER TOGETHER WITH ALL THE PRESENT AND/OR FUTURE STRUCTURES, BUILDING FURNITURE, FIXTURE AND ALL THE PRESENT AND FUTURE TITLE INTERESTAND/ORRIGHTS OF THE MORTGAGER(S) THEREIN:

FLAT NO. 504, ON 5TH FLOOR, BLOCK NO. B, (AS PER PLAN 4TH FLOOR) HAVING ITS AREA ADMEASURING 203.92 SQ. MTRS., ALONGWITH UNDIVIDED SHARE OF LAND ADMEASURING 73,39 SQ. MTRS., IN THE "SHANTANU APPARTMENT", SITUATED AT LAND BEARING PLOT, FP NO. 233 TO 234 PART, T.P.S. NO. 21, OF MOUJE VASTRAPUR, TALUKA SHANTANU CHSL VASTRAPUR AHMEDABAD NR HERITAGE TOWER AMBAWADI AHMEDABAD-380015, GUJARAT AND BOUNDED AS UNDER:

ON OR TOWARDS THE EAST ; UNIT NO. B/503

ON OR TOWARDS THE WEST : BLOCK NO. A

ON OR TOWARDS THE NORTH: UNIT NO. B/501

ON OR TOWARDS THE SOUTH : COMMON PLOT

Date : 20.01.2025 **Authorised Officer** Place: AHMEDABAD SAMMAAN FINSERVE LIMITED

(formerly known as INDIABULLS COMMERCIAL CREDIT LIMITED)

# **IDFC FIRST Bank Limited**

IDFC FIRST (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031 Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022 NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION

OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT. 2002 The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited amaigamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr	Loan	Type of	Name of borrowers and	Section 13 (2)	Outstanding amount as per
No.	Account No.	Loan	co-borrowers	Notice Date	Section 13 (2) Notice
1	40519479 &119771548	Loan Against Property	Saiyad     Mohammedumarfaruk     Saiyad Farhatbanu	28.12.2024	INR 7,17,119.46/-

Property Address: All That Piece And Parcel Shop No. 27, On Ground Floor, Admeasuring 10,698 Sq. Mtrs. Undivided Share Of Land Measuring 11.73 Sq. Mts. Situated At C.s.no. 2/951, Mouja: Kasba Borsad, Registration District & Sub District: Borsad, District: Anand, Gujarat-388560, And Bounded As: East: By Shop No. 24 . West : By Road, North : By Shop No. 26 On Ground Floor, South : Property Of C.S. No. 2/950

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

**Authorized Officer IDFC First Bank Limited** Date: 24.01.2025 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited Place : Gujarat and presently known as IDFC First Bank Limited)

### **BAID INDUSTRIES PRIVATE LIMITED (in Liquidation)** CIN: U17100GJ2007PTC050851

Registered Address: Plot No. 8, G. I. D. C. Panoli, Ankleshwar, Gujarat, India - 384116.

E-AUCTION SALE NOTICE UNDER INSOLVENCY AND BANKRUPTCY CODE, 2016 otice is hereby given to the public in general under the Insolvency and Bankruptcy Code, 2016 and the regulations made there under for Sale of Plant achinery and Land & Building (Area of Plot: 13,936 sq. Mtrs) of M/s.BAID INDUSTRIES PRIVATE LIMITED (in Liquidation) in accordance with Regulatio 2 and 33 of the Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016. The sale will be conducted by the undersigned through the

uction platform: https://right2vote.in/login as per Schedule I under Regulation 33 of the IBBI (Liquidation Process) Regulations, 2016 for the following

Block	Asset	Particulars	Reserve Price ( Rs.)	EMD Amount (Rs.)	Incremental Value (Rs.)
Α	Land & Building Along with Plant & Machinery	Site Address: Plot No. 8, G .l. D. C. Panoli, Ankleshwar, Gujarat, India - 384116	22,50,00,000.00	2,25,00,000.00	5,00,000.00
В	Only Plant & Machinery	Site Address: Plot No. 8, G .l. D. C. Panoli, Ankleshwar, Gujarat, India - 384116	5,50,00,000.00	55,00,000.00	5,00,000.00
С	Only Land & Building	Site Address: Plot No. 8, G .l. D. C. Panoli, Ankleshwar, Gujarat, India - 384116	17,00,00,000.00	1,70,00,000.00	5,00,000.00

C	Building	Plot No. 8, G .I. D. C. Pa Ankleshwar, Gujarat, India -		17,00,00,000.00	1,70,00,000.00	3,00,000.00
Submission	on of Requisite Forms,	Affidavits, Declaration etc.	From	24/01/2025 to 08/0	02/2025	
	Site visit / Inspe	ection Date	11/0	2/2025 to 18/02/202	25	
	Last Date for Subm	nission of EMD	19/02	/2025		
	Date and Time o	f E-Auction				
	Block	A	Date:	22/02/2025 Time:	01:30 PM to 02:3	BO PM IST
	Block	В	Date:	22/02/2025 Time:	03:00 PM to 04:0	00 PM
	Block	С	Date:	22/02/2025 Time:	04:30 PM to 05:3	30 PM IST

Email ID: baid.cirp@gmail.com; Mobile No.: +91 9979940961/9727247030

E-Auction Service Provider: Right2Vote InfoTech Private Limited

Terms and Condition of the E-Auction are as under: E-Auction will be conducted on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS", "NO RECOURSE BASIS" and "WHATEVER THERE IS BASIS through approved service provider, M/s Right2Vote InfoTech Private Limited. This E-Auction Notice shall be read in conjunction with the complete E-Auction Process Information Document containing details of the assets, e

auction bid form, declaration and undertakings, general terms and conditions of the e-auction sale which will be made available by contacting of Mobile No.: +91 9727247030, Email ID: baid.cirp@gmail.com in the working hours from Monday to Saturday and on the website of the E-Auctic Service Provider It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of assets put on auction will be permitted to interested bidders at sites from the date of publication to the last date of submitting documents & EMD.

Intending bidders should submit the Request Letter for participation in the E-Auction along with KYC and other documents. The formats can be taken

from the E-Auction Process Information Document. These documents should reach the office of the Liquidator through physical delivery or post/courier at the address given below on or before 8th February 2025. The eligible bidders shall submit the evidence for EMD Deposit of 10% of reserve price on or before 19/02/2025. The intending bidders are required to deposit Earnest Money Deposit (EMD) amount through Demand Draft in the name of "BAID".

INDUSTRIESPRIVATE LIMITED IN LIQUIDATION" 5.The bidders are requested to visit https://right2vote.in for detailed terms and conditions for e-auction process before submitting their bids and takin part in the e-auction sale proceedings.

3. If the auction of Block Ais successfully conducted, then auction of Block B and Block C will be cancelled.

7. If the auction of Block A is not conducted successfully, then auction of Block B will be conducted. 8.If the auction of Block B is successfully conducted, then only auction of Block C will be conducted. In case the auction of Block B is not conducted successfully, then auction of Block C will not be conducted.

IP JaykishanRathi Liquidator

**BAID INDUSTRIESPRIVATE LIMITED In Liquidation** Date: 24/01/2025 Reg. No: IBBI/IPA-001/IP-P-02710/2022-2023/14166. Place: Gujarat Add:3040, 3rd Floor, Trade House, Near Rusabh Petrol Pump, Ring Road ,Surat, Gujarat ,395002. baid.cirp@gmail.com



## **Dai-ichi Karkaria Limited**

CIN: L24100MH1960PLC011681 Regd. Off. Liberty Building, Sir Vithaldas Thackersey Marg, New Marine Lines, Mumbai: 400 020

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED 31ST DECEMBER 2024

		Standalone			Consolidated	
Particulars	Quarter ended 31 Dec 2024 (Unaudited)	Nine month ended 31st Dec 2024 (Unaudited)	Quarter ended 31 Dec 2023 (Unaudited)	Quarter ended 31 Dec 2024 (Unaudited)	Nine month ended 31st Dec 2024 (Unaudited)	Quarter ended 31 Dec 2023 (Unaudited)
Total Income from operations	4,198	11,437	3,593	4,198	11,437	3,593
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	102	41	29	102	41	29
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	255	194	29	255	194	29
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	191	127	59	191	127	59
Total Comprehensive Income/(Expense) for the period (Comprising Income/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) }	191	127	58	261	281	111
Paid up Equity Share Capital ( Face Value Rs 10 each)	745	745	745	745	745	745
Other equity excluding revaluation reserve as shown in the Audited Balance Sheet of the previous year	15,342	15,342	15,342	17,331	17,331	17,331
Earnings per share Basic and Diluted in Rs. (of Rs.10/- each)(Not annualised)	2.56	1.71	0.80	3.52	3,79	1,47

- The above is an extract of the detailed format of unaudited standalone and consolidated financial results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results are available on the Stock Exchange website - www.bseindia.com and the Company's website -www.dai-ichiindia.com.
- The above unaudited standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 23 January 2025. The figures for the quarter and nine month ended 31 Decembe 2024 have been subjected to limited review by the statutory auditors. The auditors have expressed a unmodified opinion on the limited review report for the quarter ended 31 December 2024.
- 3) The Company's management, pursuant to 'ind AS 108 Operating Segments' has concluded that the Company has only one reportable segment which is Specialty Chemicals. Accordingly, no separate disclosures of segment information have been made.
- 4) During the current quarter, the Company sold its tenancy rights to a property situated in Mumbai for a total consideration of Rs 153 lakhs This transaction has resulted in a gain of Rs 153 lakhs, which has been recognized as an exceptional item in the financial statements.
- Pursuant to a fire incident on 22 November 2020 at Dahej factory situated at Plot no. D-2/20, GIDC, Tal. Vagra, Dist. Bharuch 392130. Gujarat, certain property, plant and equipment and inventory were damaged. It also disrupted the production process and impacted the financial performance of the Company for the year ended 31 March 2021. As a result of the incident, the Company had recognised a loss of Rs. 4,932 lakhs (Rs. 4,326 lakhs towards property plant and equipment, Rs. 581 lakhs towards inventories and Rs.25 lakhs towards other expenses) as an exceptional item in the standalone financial results for FY 2020-21. The Company's assets and inventories are covered under an Insurance policy and a claim has been lodged with the Insurance Company for the losses suffered. The Company has received an interim payment towards insurance claim of Rs 400 lakhs in FY 2021-22 and stock insurance claim of Rs 285 lakhs in FY 2022-23. During the previous year, the Company has received full and final settlement of fire insurance claim amounting to Rs 2,058 lakhs on 12 September 2023 which is recognised as an exceptional item.
- Figures are rounded off to the nearest lakh.

Place: Mumbai

Dated: 23 January 2025



For and on behalf of the Board

Ms. S. F. Vakil Chairperson and Wholetime Director

# **IDFC FIRST Bank Limited**

erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) | CIN : L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

as per contractual rate with effect from their respective dates.

IDFC FIRST

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the

Sr	Loan	Type of	Name of borrowers and	Section 13 (2)	Outstanding amount as per
No.	Account No.	Loan	co-borrowers	Notice Date	Section 13 (2) Notice
	10061720558 & 10136585809	50000	M/s Shree Ram Powder     Products     Akshay Jentibhai Nathani     Javnilal Bharvanihhai Nathani	11.01.2025	INR 75,44,701.00/-

following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged

Property Address: All That Piece And Parcel Of An Open Land Of Industrial Land Admeasuring 1335.59 So Mts. Of Plot No. 15, 16 & Sub-plot No. 17/1 & 17/2 (land Adm. 385, 35 + 334,00 Sq. Mts. Of Sub-plot No. 17/1 & 17/2 And Land Adm. 321.65 Sq. Mts. Of Plot No. 16 And Land Adm. 294.59 Sq. Mts. Of Plot No. 15) Of Area Known As "radhika Industrial Zone", Situated In Total Land Adm. 16086.00 Sq. Mts. Of Revenue Survey No. 75 Of Village Aniyala Of Tal. Rajkot, District: Rajkot, Gujarat-360020, And Bounded As:-

Boundaries Of The Plot No. 15:- East: Road Of 9.0 Mts, It Adm. 14.00 Mts., West: Place Of Tree Plantation It Adm. 15.37 With Cros. North: Plot No. 16, It Adm. 18.80 Mts., South: Common Plot, It Adm. 25.66 Mts. Boundaries Of The Plot No. 16:- East: Road Of 9.0 Mts, It Adm. 14.00 Mts., West: Place Of Tree Plantation, It Adm. 16.30 With Cros, North: Sub-plot No. 17/1, It Adm. 27.15 Mts., South: Plot No.15, It Adm. 18.80 Mts. Boundaries Of The Plot No. 17/1: - East: Road Of 9.0 Mts, It Adm. 14.00 Mts., West: Adjoining Survey No. 76 It Adm. 14.02 Mts., North: Sub-plot No. 17/2, It Adm. 27.90 Mts., South: Plot No. 16, It Adm. 18.80 Mts. Boundaries Of The Plot No. 17/2: East: Road Of 9.0 Mts, It Adm. 13.86 Mts., West: Adjoining Survey No. 76 It Adm. 11.94 Mts., North: Adjoining Survey No. 12p, It Adm. 28.95 Mts., South: Sub-plot No. 17/1, It Adm.

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile IDFC Bank Limited and presently known as IDFC FIRST Bank Limited) Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

**Authorized Officer IDFC First Bank Limited** (erstwhile IDFC Bank Limited and presently Date: 24.01.2025 known as IDFC FIRST Bank Limited) Place : Gujarat

Rajkot Nagarik Sahakari Bank Ltd.

**Possession Notice** 

(For Immovable Property) (Multistate Scheduled Bank) R.O. & H.O.: "Arvindbhai Maniar Nagarik Sevalay", 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot. Ph. 2555716 The undersigned being the authorized officer of Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O. Rajkot under the

Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 Section 13(2) and in exercise of powers conferred under the Security Interest (Enforcement) Rules, 2002 Issued a demand notice dated 12/04/2024 by Regd.A.D. Post and public notice on 22/05/2024 in Daily Newspaper "THE INDIAN EXPERESS" and "SANDESH" calling upon the borrower Lakhdhir Gaurang Vithalbhai to repay the amount mentioned in the notice being Rs.9,72,976.00 (Rupees Nine Lacs Seventy Two Thousand Nine Hundred Seventy Six Only) and interest thereon due from 01/04/2024 within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, guarantors and the public in general that the undersigned has taken possession of Property described herein below on 19/01/2025 through the Court Commissioner, in pursuance of the Order Dt.17/12/2024 issued by the Hon. Chief Judicial Magistrate Junagadh under section 14 of the SARFAESI Act-2002. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the following property and any dealing with this property will be subject to the charge of Rajkot Nagarik Sahakari Bank Ltd., Rajkot for an amount outstanding as on 31/12/2024, Rs.10,56,639=00 (Rupees Ten Lacs Fifty Six Thousand Six Hundred Thirty Nine Only) + interest thereon due from 01/01/2025. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

### Description of Property

Immovable Property Situated in Junagadh District, Sub-Dist. Junagadh within the limit of Mahanagarpalika Moje Village Timbavadi Revenue Survey No.21/1 admeasuring land area Acre 3-38 Guntha which converted in to Non-agri. land for Residential Purpose and as per its Layout Approved Plots Paiki Plot No.23 Paiki land admeasuring area 291-82 Sq. Yards, 244-00 Sq. Mtr. which sub plotting approval Sub-Plot No.23/C land admeasuring area 96-815 Sq. Mtr. and thereon Constructed Store Room/Shop No.-7 which Carpet area 18-20 Sq. Mtr. and Built-up area approx 21-84 Sq. Mtr. acquired wide Reg. Sale deed No.8176, Dated. 03/12/ 2021 in the name of Lakhdhir Gaurang Vithalbhai and bounded by as under:

North :- Adjoined Store Room/ Shop No.-6 South :- Adjoined 12-19 Meter Wide Cart Track East :- Adjoined 7-50 Meter Wide Road West :- Adjoined Land Of Sub Plot No. 23A+23B

Property Address: - Shop No.7, Paresh Nagar, Behind Darghah, Timbavadi, Vanthali Road, Junagadh 362001 (Gujarat) Dt. 22/01/2025

Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Dept., Rajkot.

## RESTILE CERAMICS LIMITED

Reg office: 204, Sakar Complex, Opp ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat-390015 CIN:L26931GJ1986PLC102350

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024 [See Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015] (Rs. In Lakhs)

_	(1 to: III Editio)							
Sr.		Quarter Ended			Nine Months Ended		Year Ended	
No.	Particulars	31-Dec-24	30-Sep-24	31-Dec-23	31-Dec-24	31-Dec-23	31-Mar-24	
	8	Unudited	Unudited	Unudited	Unudited	Unudited	Audited	
1.	Total Income from Operations	26.85	31.10	35.05	108.48	92.55	113.01	
2.	Net Profit/(Loss) for the period (Before Tax and/or Exceptional items)	(24.34)	(25.86)	(11.05)	(73.85)	(62.48)	(91.10)	
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(24.34)	(25.86)	(11.05)	(73.85)	(62.48)	(91.10)	
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	(24.34)	(25.86)	(11.22)	(73.85)	(62.65)	(91.27)	
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(24.22)	(25.75)	(11.35)	(73.51)	(62.50)	(90.82)	
6.	Equity Share Capital	9827.92	9827.92	9827.92	9827.92	9827.92	9827.92	
7.	Other Equity as shown in the Audited Balance Sheet						(12,898.91)	
8.	Earnings per share (of Rs. 10/- each) for continuing operations-(not annualised)							
Ш	1. Basic:	(0.02)	(0.03)	(0.01)	(0.07)	(0.06)	(0.09)	
	2. Diluted:	(0.02)	(0.03)	(0.01)	(0.07)	(0.06)	(0.09)	

A SHISHIE

Rajkot.

The above is an extract of the detailed format of Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of SEB (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the Company's web site (www.restile.com)

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on January, 23, 2025.

Viren Rathod Place : Chennai **Date: January 23, 2025 Managing Director** 

इंडियन बैंक 🚜 Indian Bank

STRESSED ASSET MANAGEMENT BRANCH 2nd Floor, Desna Shopping Complex, Usmanpura Chauraha, Ashram Road, Ahmedabad-380014 M.: 8478937847, E-Mail: armbahmedabad@indianbank.co.in

Letter to Borrower Communicating the Decision of Wilful Defaulter Review Committee Classifying as Wilful Defaulter

 Vimal Phoolchand Goel (Borrower) 1. Flat no -301 Flat No. 301, RFoyal Meadows, D. No. 3-4-143, 144, 144/11, Barkat Pura, Hyderabad-500027, Telangana Pin-

M/s GM JEMS AND JEWELS PVT LTD

H. NO. 3-3-68 FLAT NO -101, SREE RAMA ENCLAVE, KACHIGUDA, TELANGANA, 3.SHOP NO 7A, MAHALAXMI GEMS AND JEWELLERY MALL, CHIRAG ALI LANE ABI SECUNDERABAD, CB HYDERABAD

Sharda Vimalchand Goel (Borrower)

Flat no -301 Flat No. 301, RFoyal Meadows, D. No. 3-4-143, 144, 144/11, Barkat Pura, Hyderabad-500027, Telangana Pin-

M/s GM JEMS AND JEWELS PVT LTD

H.NO.3-3-68 FLAT NO -101, SREE RAMA ENCLAVE, KACHIGUDA, TELANGANA 3. SHOP NO 7A, MAHALAXMI GEMS AND JEWELLERY MALL, CHIRAG ALI LANE ABI SECUNDERABAD, CB HYDERABAD

Dear Sir, We hereby inform you that our Bank has classified the Borrowers Borrower Mr. Vimal Phoolchand Goel & Mrs. Sarda Goel as Wilful Defaulter as per RBI Master Circular on Wilful Defaulter dated 01.07.2015. The proceeding of Wilful Defaulter Classification is as

The Wilful Defaulter Screening Committee in its meeting held on 15.10.2022 considered the following information and records placed

Grounds of Wilful Default: Action of the unit/company, which is/are out of the Reason & evidence which proves the action of the unit/company &

four actions set out by Reserve Bank of India for also support justification for declaration as wilful Defaulter Declaration as Wilful Defaulter Clause 2.1.3(c) - Siphoning of Funds:

SCN Issuance and its response:

other assets

The unit has defaulted in meeting its payment / and Mrs. Sharda Goel for purchasing two bungalows at sub Plot No 6/A repayment obligations to the lender and has siphoned and 13/A with two term loan of Rs. 4.50 Cr for each bungalow. Project cost off the funds so that the funds have not been utilized for of each bungalow was Rs. 6.25 Cr (Land Value of RS. 2.50 Cr + the specific purpose for which finance was availed of, construction cost of Rs. 1.10 Cr + finishing work of Rs. 2.65 Cr). The sale nor are the funds available with the unit in the form of agreement of Rs. 2.50 Cr and construction agreement of Rs. 1.10 Cr was made between M/s Manay Infrastructure Pvt, Ltd, and borrower, Mr. Vimal Phoolchand Goel and Mrs. Sharda Goel. Similarly finishing agreement of Rs. 2.65 Cr was made between M/s Ganesh Construction and the above borrowers. On 29:11,2013 Rs. 3.73 Cr and Rs. 3.90 Cr was disbursed for bungalow 6/A and bungalow No 13/A but margin money of the borrower was not verified.

Housing loan was sanction to the borrower Mr. Vimal Phoolchand Goel

On 12.12.2013 loan amount of Rs. 76.53 Lac and Rs. 59.33 Lac was disbursed from term loans and credited to SB account No. 50179539820. of Mr. Vimal Phoolchand Goel and which was onward remitted to current account No. 200920110001061 of M/s Ganesh Construction maintained with Bank of India through RTGS. On same day above disbursed amount remitted back by same account of M/s Ganesh Construction in the account of Mr. Vimal Phoolchand Goel bearing account No. 50043861253 maintained with Himavath Nagar branch, Hyderabad. This clearly shows that borrower has colluded with the contractor and misutilised the fund for other purposes other than it was sanctioned for. Further the valuation figure was also provided at higher side at the time of

sanction to avail higher limit of Housing loan. The Committee after deliberation, had taken a prima facie view based on the evidences/ material records placed that the Borrowers Mr. Vimal Phoolchand Goel & Mrs. Sarda Goel may be classified as wilful defaulters for Siphoning of fund under clause 2.1.3 (c) of RBI Master Circular on wilful defaulter dated 01.07.2015 and approved for issuance of show cause notice on the above grounds.

The Show Cause Notice sent vide letter dated 14.11.2022 by FGMO Mumbai and that. Notices was not serviced/delivered to the Borrowers, Paper publication was done on 21.12.2022.

No reply/representation is received from the Borrowers against our Show Cause Notice dated 14.11.2022.

Wilful Defaulter Screening Committee Meeting held on 07.02.2023: The facts & evidences placed before the Wilful Defaulter Screening Committee (WDSC) in support of Bank's charge / allegation for

declaring The Borrower as wilful defaulter are perused, analysed & examined. The Committee recorded that the Borrowers Mr. Vimal Phoolchand Goel & Mrs. Sarda Goel have not replied to the Show Cause Notice (SCN) dated 14.11.2022, addressing the allegations mentioned therein. The Committee observed that they are not interested to express their views for not declaring them as wilful defaulter and it also tantamount to acceptance of the allegations mentioned in the SCN. Further, since the Borrower has not replied to the SCN the opportunity of providing personal hearing does not arise.

Thereafter, after due deliberations and going by the records, Wilful Defaulter Screening Committee has unanimously passed an order declaring the Borrowers Mr. Vimal Phoolchand Goel & Mrs. Sarda Goel as wilful defaulter for Siphoning of Funds in terms of clause 2.1.3 (c) of RBI Master Circular on Wilful Defaulter dated 01.07.2015.

Order of Wilful Defaulter Screening Committee passed in meeting held on 07.02.2023 and its response: As per the provision of the NPA Management Policy 2023-24 of the Bank, order of Wilful Defaulter Screening Committee passed in the meeting held on 07.02.2023, was communicated to the Borrower by the Branch on 17.02.2023 and the same was returned undelivered, Paper publication of WD Order was done on 13.03.2023. For which, no reply/representation was received from the

Wilful Defaulter Review Committee - Meeting on 15.06.2023:

The order of Wilful Defaulter Screening Committee (WDSC) dated 07.02.2023 was placed before the Wilful Defaulter Review Committee for review and further orders.

The observations mentioned above clearly indicates for defaulter for Siphoning of Funds in terms of clause 2.1.3 (c) of RBI Master Circular on Wilful Defaulter dated 01.07.2015.

Wilful Defaulter Review Committee in its meeting held on 15.06.2023 has reviewed and deliberated that borrower has not replied/represented against the order of WDSC despite intimation through paper publication. As such Wilful Defaulter Review Committee confirmed the WDSC order dated 07.02.2023, declaring the Borrowers Mr. Vimal Phoolchand Goel & Mrs. Sarda Goel as Wilful Defaulter for defaulter for Siphoning of Funds in terms of clause 2.1.3 (c) as per RBI master circular on Wilful Defaulter dated 01.07.2015 after taking into consideration of facts / evidences / material documents.

In view of the above, we hereby inform you that Wilful Defaulter Review Committee classified you all as "Wilful Defaulter". As such, the Bank will proceed further to inform your details to RBV CIC within 7 days of the following month:

Branch Manager Place : Ahmedabad On behalf of Wilful Defaulter Review Committee Date: 03/01/2025

financialexp.epapr.in

Ahmedabad



# REDTAPE

#### **REDTAPE LIMITED**

Corporate Identification Number (CIN): L74101UP2021PLC156659 Regd. Office: Plot No. 8, Sector 90, Gautam Buddha Nagar, Noida-201301, Uttar Pradesh, India

Phone: + 91 120-6994444 Email: <a href="mailto:compliance@redtapeindia.com">compliance@redtapeindia.com</a> Website: <a href="mailto:www.redtape.com">www.redtape.com</a>

Notice to the Members of the Company

Record Date for Issue of Bonus Equity Shares Record Date for Issue of Bonus Equity Shares
Notice is hereby given that the Company has fixed Tuesday, February 4, 2025, as the
'Record Date' for the purpose of determining the members of the Company eligible for,
bonus equity shares in proportion of 3:1 i.e., 3 (Three) new fully paid-up equity shares
of Rs. 2/- (Rupees Two only) each for every 1 (One) existing fully paid-up equity shares
of Rs. 2/- (Rupees two only) each ('Bonus Shares').
The Bonus Shares shall be allotted to the members of the Company whose names
appear in the Register of Members/ Register of Beneficial Owners maintained by the
Depositories, as on the Record Date.
The Bonus Shares, once allotted, shall rank Pari passu in all respects with the fully
paid-up equity shares of the Company as existing on the Record Date and shall always.

paid-up equity shares of the Company as existing on the Record Date and shall always be subject to the terms and conditions contained in the Memorandum and Articles of

Association of the Company.

Pursuant to the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, new Bonus Shares shall be allotted in dematerialised form only. With respect to the Bonus Shares of the members holding equity in Physical form who have not provided their demat account details to the Company, the said Bonus Shares shall be credited in dematerialised form to a demat suspense account till they are credited to the beneficiary accounts of the respective members holding equity shares in physical form.

For REDTAPE Limited For REDTAPE Limited

Place: Noida Date: 23rd January, 2025

Akhilendra Bahadur Singl Company Secretary & Compliance Officer (ACS 54305)



રીજીયન ઓફિસ **લાલ દરવાજા. અમદાવાદ - ૩૮૦ ૦૦૧** 

परिशिष्ट-४ [नियम-८(९)] **ક्छान्त नो**हिस (स्थावर भिस<del>डत</del> माहे)

નીચે જણાવેલ **સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, જમાલપુર, આસ્ટોડિયા , જી. અમદાવાદ.**ના અધિકૃત अधिडारी द्वारा सिड्योरिटाछ्रोशन એन्ડ रीडन्स्ट्रेड्शन ओई इंछनान्सियल એसेट्स ऄन એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, २००२ ना सेક્શન ૧૩(૧૨) અને તેની સાથે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ના નિયમ ૩ને વાંચતાં આ **ડિમાન્ડ નોદિસ તા. ૧७.૦૮.૨૦૨૪** ના જારી કરવામાં આવી છે જેના દેવાદાર **શ્રી હિરેન મુકેશભાઇ જોપી, શ્રીમત જોવી હિરેન ભુમિકા(સહ-દેવાદાર)**ને નોટિસમાં જણાવેલી <del>૨</del>કમ જે **રૂ. ૩૧,૦૪,૬૧૫,૫૫/- (રૂપિસા** એકત્રીસ લાખ **ચાર હજાર છસ્સો પંદર અને પંચાવન પૈસા પૂરા)** અને તે પરનું વ્યાજ અને આકસ્મિ ખર્ચામાં ઉપરોક્ત નોટીસની તારીખથી દૃ૦ દિવસમાં ચૂકવૈવાનું જણાવવામાં આવ્યું હતું. દેવાદાર સ્ક્રમની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદારો અને જાહેર જનતાને જાણ કરવા

આવે છે કે નીચે સહી કરનારે નીચે વણવેલ મિલકત જે ગીરવે મૂકેલી છે, તેનો **પ્રત્યક્ષ કબનો** કથિત એક્ટન ਪੇਟ। કલમ (४) અને કલમ 93 અને તેની સાથે રુલ ૮ અને રિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિય ૨૦૦૨ ને વાંચતા મળેલી રાતાનો ઉપયોગ કરીને **તા. ૨૧-૦૧-૨૦૨૫**ના રોજ મેળવી લીધો છે.

ખાસ કરીને દેવાદાર તથા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મિલકત અંગે કોઇ પ્રકારન વ્યવહાર કરવો નહીં અને જો કોઇ વ્યવહાર કરવામાં આવશે તો તે રકમ **રોન્ટલ બેંક ઓ**ર ઇ**ब्डि**याना લેણાં નીકળતા **રૂ. ૩૧,૦૪,૬૧૫,૫૫/- (રૂપિયા એક્ઝીસ લાખ ચાર હજાર છસ્સો** પંદર અને પંચાવન પૈસા પૂરા) એટલે કે ૧७.૦૮.૨૦૨૪ મુજબ વ્યાજ વત્તા અન્ય ચાર્જસ વગેરે. નોટિસમાં દર્શાવેલ વ્યાજ અને તેના પરના વધુ વ્યાજ અને (૧૩)(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ જારી કર્ચા પછી જમા કરવામાં આવેલી રકમ પ્રભાવી થઈ ગઈ છે

સલામત મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમચ અંગે આ કાચદાની પેટા કલમ ૧૩(૮)ની જોગવાઈ અંગે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્શન મોર્ગેજ કરેલી મિલકતનો ફ્લેટ નંબર એ-૨૦, એ પ્લોક (મંજૂર પ્લાન મુજળ પ્લોક સી), ચોથો માળ, ૧૧૨.૦૪ ચોરસ મીટર, સુપર બિલ્ટ અપ એરિયા સાથે અવિભાજીત જમીનનો હિસ્સો ૪૨.૪૧ ચો.મી. જે પ્લોક/સર્વે નં. દૃદુપ પી ૪ પી નો ખાતા નં. ૨૬૭૦ ની જાણીતી સ્કીમ બિનાલી શોપ્સ અને રેસીકેન્થી , ક્પાડલેજ રોડ અને ગામ કહવાલ , તાલુકો કહવાલ અને જુલ્હો ખેડા, જેની ચતુર્સીમા નીચે મુજબ છે. **પૂર્વઃ** ફ્લેટ નં એ/૧૯ , **પશ્ચિમઃ** - લીફર , **ઉત્તરઃ** - પાછળની બાજુનો રોડ, **દક્ષિણઃ** સોસાયટી રોડ અને પેસેજ વચ્ચે બ્લોક સી અને ડી

અધિકૃત અધિકારી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તારીખ : ૨૧.૦૧.૨૦૨૫



Ujjivan Small Finance Bank Limited Registered Office and Head Office: Grape Garden, No. 27, 3rd "A" Cross, 18th Main, 6th Block, Koramangala, Bengaluru-560 095, Karnataka, India; Tel: +91 80 4071 2121
Website: www.ujjivansfb.in; E-mail: investorrelations@ujjivan.com

Corporate Identity Number: L65110KA2016PLC142162 Statement of Financial Results for the Quarter and

Nine Months ended December 31, 2024

		Quarte	Nine Months ended	
SL No.	Particulars	Particulars December 31, 2024 December 31, 2023		December 31, 2024
		Unaudited	Unaudited	Unaudited
1.	Total Income from Operations	1,76,324	1,65,539	5,35,755
2,	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	13,637	39,439	84,633
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	13,637	39,439	84,633
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	10,862	30,006	64,273
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	Е	-
6.	Equity Share Capital	1,93,454	1,95,654	1,93,454
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	3,60,974	2,00,318	3,60,974
8.	Earnings per Share (EPS)  1. Basic (₹):  2. Diluted (₹):	0.56 0.56	1.53 1.50	3.32 3.28

Notes:

1. The above results were reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their meeting held on January 23, 2025. 2. The Limited Review under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been carried out by the Statutory Auditors. An unqualified report has been issued by them thereon.

3. The information related to the total comprehensive income and other comprehincome has not been furnished as IND AS is not yet made applicable to the Bank.

4. The Bank has followed the same significant accounting policies in the preparation of these financial results as those followed in the annual financial statements for the year ended March 31, 2024.

5. The above is an extract of the detailed format of quarterly financial results filed with 13. The abovers an extract of the detailed by the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter ended December 31, 2024 is available on the Stock Exchanges vebsites www.nseindia.com and www.bseindia.com and also on the Bank's website https://www.ujjivansfb.in/financial-results. The same can be assessed by scanning



Date: January 23, 2025

For and on behalf of Board of Directors of UJJIVAN SMALL FINANCE BANK LIMITED

Sanjeev Nautiyal Managing Director and CEO DIN: 08075972

# **Empowering India's Green Energy Goals Through**

**ADVERTORIAL** 

sustainable energy

focus on using indi-

genous solar modules and

Lord's Mark's

solutions.

adhering to the highest national

standards reflects its dedication to

quality and innovation. This commit-

ment has earned the industry's trust,

thus positioning Lord's Mark as a key

player in driving India's transition

Mark Industries' Managing Director, Mr

Sachidanand Upadhyay, has been invited to the prestigious World Eco-

nomic Forum in Davos. Representing

India, Mr. Upadhyay will highlight

groundbreaking innovations in

renewable energy and healthcare technology, further cementing the

company's reputation as a trailblazer in

As Lord's Mark expands its re-

MedTech and economic development.

Adding to this momentum, Lord's

towards a greener future.

## **Innovation and Trust Lord's Mark Industries Upholds**

PM's Vision of Surya Ghar: Muft Bijli Yojana

Lord's Mark Industries systems on the rooftops of Limited has once again autonomous bodies and subordinate offices, the demonstrated its leadership in reprogram maximises newable energy, energy generation while setting new securing a prestigious 100 MW bench marks for contract under the cost-effective and

Energy Development Agency (UPNEDA) program. We are very much pleased to announce that our existing 50 MW contract has been extended to additional 100MW seeing the capability and performance of our company. This achievement raises the company's total capacity to an impressive more than 150 MW. This milestone reaffirms Lord's Mark's Industries

Uttar Pradesh New

and Renewable

energy agenda forward. The latest contract will see Lord's Mark install grid-connected rooftop solar systems on government and semigovernment buildings as part of the RESCO model on a net metering basis.

commitment to driving India's sustainable

Aligned with PM Surya Ghar: Muft Bijli Yojana, this initiative targets the completion of installations across central and state government buildings by December 2025. By integrating

solar energy Lord's 26th Anniversary #HameshaAapkeSaath

newable energy portfolio and showcases its capabilities on global platforms, its vision of building a sustainable future takes centre stage. With each milestone, the company exemplifies excellence, innovation, and unwavering dedication to a better tomorrow. Thus, aligning with India's broader vision of a green

and self-reliant energy future.



સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ શાખા ું માળ. દેસના શોપીંગ કોમ્પલેક્ષ, ઉસ્માનપુરા ચૌરાહા भो.: ८४७८६३७८४७, **б-**भेख : armbahme

વિલફુલ કિફોલ્ટર સમીક્ષા સમિતિ હારા વિલફુલ કિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરાયેલા નિર્ણયની જાણ કરતો ઉધાર લેનારને પત્ર

વિમલ ફુલચંદ ગોચલ (દેવાદાર)

૧. ફ્લેટ નં. ૩૦૧, ફ્લેટ નં. ૩૦૧, આરફોચલ મેડોઝ, ડી. નં. ૩-૪-૧૪૩,૧૪૪,૧૪૪/૧૧, બરકત પુરા, હેદરાબાદ - ૫૦૦૦૨૭, તેલંગાણા, પીન-

એચ.નં.૩-૩-૬૮,ફ્લેટનં.૧૦૧,શ્રી રામ એન્કલેવ,કાચીગુડા, તેલંગાણ ૩.શોપ નં.૭એ , મહાવશ્મી જેમ્સ એન્ડ જ્વેલરી મોલ , ચિરાગઅલી લેન એબીઆઈ સિકંદરાબાદ , સીબી હૈદરાબાદ

શારદા વિમલચંદ ગોએલ (દેવાદાર)

. ફ્લેટ નં. ૩૦૧, ફ્લેટ નં. ૩૦૧, આરફોચલ મેડોઝ, ડી. નં. ૩-૪-૧૪૩,૧૪૪,૧૪૪/૧૧, બરકત પુરા, હેદરાબાદ - ૫૦૦૦૨૭, તેલંગાણા, પીન-૫૦૦૦૨૭ મે. જીએમ જેમ્સ એન્ડ જવેલ્સ પ્રા. લિ.

એચ. નં. ૩-૩-૬૮, ફ્લેટ નં. ૧૦૧, શ્રી રામ એન્ક્લેવ, કાચીગુડા, તેલંગાણ

૩.શોપ નં.૭એ , મહાલક્ષ્મી જેમ્સ એન્ડ જ્વેલરી મોલ , ચિરાગઅલી લેન એબીઆઈ સિકંદરાબાદ , સીબી હૈદરાબાદ પ્રિચ સ**૨/મેડ**મ

અમે તમને અહીં માહિતી આપીએ છીએ કે અમારી બેંકે દેવાદાર શ્રી વિમલ કુલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલ ને ૦૧.૦૭.૨૦૧૫ ના રોવ ોલકુલ ડિફોલ્ટર પર આરબીઆઇના માસ્ટર સર્ક્યુલર મુજબ વિલકુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કર્યા છે. વિલકુલ ડિફોલ્ટર ક્લાસિફિકેશનની કાર્યવાહી

. વિલકુલ ડિફોલ્ટર સ્ક્રિનિંગ કમિટીએ ૧૫.૧૦.૨૦૨૨ના રોજ યોજાયેલી તેની બેઠકમાં નીચેની માહિતી અને રેકોર્ડને ધ્યાનમાં લીધા હતા.

વિલર્ફુલ મૂળભૂતનાં આદ્યારોઃ વિલકુલ કિરોલ્ટર તરીકે કિક્લેરેશન માટે કારણ અને પુરાવા જે એક્મ/કંપનીની કાર્યવાહીને સાબિત કરે છે અને કરાદાપૂર્વક કિરોલ્ટર તરીકે रिअर्व भेंड ओड़ छन्डिया द्वारा निर्धारित यार

કલમ ૨.૧.૩(સી) - ભંડોળનું સાઇફનિંગઃ આ ચુનિટે ધિરાણક્તિનિ તેની ચુકવણી/ ચુક્વણીની જવાબદારીઓ પૂરી કરવામાં ડિફોલ્ટ કર્યું છે અને ભંડોળની ઉચાપત કરી છે. કરવામાં આવ્યો ન હોય, જેના માટે નાણાંને લાભ લેવામાં આવ્યો હતો, ન તો અન્થ અ<del>સ્ક</del>्यामतोना ३५मां युनिट पासे ભંડોળ ઉપલબ્ધ હોચ

SCN જારી અને તેનો પ્રતિભાવ:

લોન લેનાર શ્રી વિમલ ફૂલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલને સબ પ્લોટ નંબર દૃ/એ અને ૧૩/એ ખાતે બે બંગલા ખરીદવા માટે મંજૂર કરવામાં આવી હતી , જેમાં પ્રત્યેક બંગલા માટે રૂા. ૪.૫૦ કરોડની બે ટર્મ લોન આપવામાં આવી હતી. દરેક બંગલાના પ્રોજેક્ટનો ખર્ચ રૂા. દૂ .૨૫ કરોડ હતો (રા. ૨.૫૦ કરોડની જમીનની કિંમત + રા. ૧.૧૦ કરોડનો બાંધકામ ખર્ચ + રા. ૨.૬૫ કરોડનું જેથી ભંડોળનો ઉપયોગ ચોક્કસ हेतु માટે ફિનિશિંગ કામ). મેસર્સ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને દેવાદાર શ્રી વિમલ ફૂલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલ વસ્થે 31. ૨.૫૦ કરોડના વેચાણ કરાર અને 31. ૧.૧૦ કરોડના બાંધકામ કરાર કરવામાં આવ્યા હતા. એ જ રીતે મેસર્સ ગણેશ કન્સ્ટ્રક્શન અને ઉપરોક્ત ઋાશદારકો વચ્ચે રૂા. ૨.૬૫ કરોડનો અંતિમ કરાર કરવામાં આવ્યો હતો. ૨૯.૧૧.૨૦૧૩ના રોજ બંગલા ૬/એ તથા બંગલા નં.૧૩/એ માટે રા. ૩.૭૩ કરોડ અને રા. ૩.૯૦ કરોડની વહેંચણી

કરવામાં આવી હતી પરંતુ લોન લેનારની માર્જિન મનીની ખરાઈ કરવામાં આવી ન હતી. ૧૨.૧૨.૨૦૧૩નાં રોજ રાં. ૭૬.૫૩ લાખ અને રા. ૫૯.૩૩ લાખની લોનની રક્ય ટર્મ લોનમાંથી વહેંચવામાં આવી હતી અને શ્રી વિમલ ફૂલચંદ ગોચલનાં એસબી એકાઉન્ટ નં .૫૦૧૭૯૫૩૯૮૨૦ પર જમા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને આરટીજીએસ મારફતે બેંક ઓફ ઇન્ડિયા સાથે સંચાલિત મેસર્સ ગણેશ કન્સ્ટ્રક્શનનાં ચાલુ ખાતા નં. ૨૦૦૯૨૦૧૧૦૦૦૧૦૬૧ મોકલવામાં આવી હતી. તે જ દિવસે, શ્રી વિમલ ફુલચંદ ગોચલના ખાતામાં મેસર્સ ગણેશ કન્સ્ટ્રક્શનના એ જ ખાતા હારા પરત મોકલવામાં આવેલી રકમ, જેનો ખાતા નં. ૫૦૦૪૩૮૬૧૨૫૩ હિમાયત નગર શાખા, હૈદરાબાદ પાસે રાખવામાં હતું. આ સ્પષ્ટપણે બતાવે છે કે દેવાદારે કોન્ટ્રાક્ટર સાથે જોડાણ કર્યું છે અને ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી તે સિવાચના અન્ય હેતુઓ માટે તેનો ખોટો ઉપયોગ

વધુમાં, હાઉસિંગ લોનની ઊંચી મર્ચાદા મેળવવા માટે મંજૂરી સમયે મૂલ્યાંકનનો આંકડો પણ ઉચ્ચ બાજુએ પૂરો પાડવામાં આવ્યો હતો.

સમિતિએ ચર્ચા-વિચારણા પછી, પુરાવા/મહત્વપૂર્ણ રેકોર્ડના આધારે પ્રથમ દૃષ્ટિએ એવો અભિપ્રાય આપ્યો હતો કે દેવાદારો શ્રી વિમલ ફૂલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલને ૦૧.૦૭.૨૦૧૫ ના રોજ આરબીઆઈ માસ્ટર પરિપત્રના વિલકુલ ડિફોલ્ટર પરના કલમ ૨.૧.૩ (સી) હૈઠળ ભંડોળના સાઇફનિંગ માટે જાણી જોઈને ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરી શકાય છે અને ઉપરોક્ત આદારો પર કારણ બતાવો નોટિસ જારી કરવા માટે

FGMO મુંબઇ દ્વારા ૧૪.૧૧.૨૦૨૨ ના રોજ પત્ર દ્વારા કારણ બતાવો નોટિસ મોક્લવામાં આવી હતી અને દેવાદારોને નોટિસ બજાવવામાં/વિતરિત

કરવામાં આવી ન હતી , કાગળ પર ૨૧.૧૨.૨૦૨૨ ના રોજ પ્રકાશન કરવામાં આવ્યું હતું . ૧૪.૧૧.૨૦૨૨ ના રોજ અમારી કારણ બતાવો નોટિસ સામે દેવાદારો તરફથી કોઈ જવાળ/પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી . ૦७.૦૨.૨૦૨૩ ના રોજ વિલકુલ ડિફોલ્ટર સ્ક્રીનીંગ કમિટીની બેઠક ચોજોઇ:

દેવાદારને વિલકુલ ડિફોલ્ટર જાહેર કરવાના બેંકના આરોપ/આરોપના સમર્થનમાં વિલકુલ ડિફોલ્ટર સ્ક્રીનીંગ કમિટી (WDSC) સમક્ષ રજૂ કરાચેલા તથ્યો અને પુરાવાઓનો અભ્યાસ, વિશ્લેષણ અને તપાસ કરવામાં આવી છે.

મમિતિએ નોંધ્યું છે કે દેવાદાર શ્રી વિમલ ફૂલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલએ ૧૪.૧૧.૨૦૨૨ ના રોજ આપવામાં આવેલી કારણદર્શક નોટિસ (SCN) નો જવાળ આપ્યો નથી, જેમાં તેમાં ઉલ્લેખિત આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમિતિએ અવલોકન કર્યું હતું કે તેઓ તેમને વિલકુલ ડિફોલ્ટર જાહેર ન કરવા બદલ તેમના મંતવ્યો વ્યક્ત કરવામાં રસ ધરાવતા નથી અને તે SCN માં ઉલ્લેખિત આરોપોને સ્વીકારવા સમાન છે. વધુમાં , શ્રહ્ય લેનારએ જીઝદ્ર ને જવાબ આપ્યો ન હોવાથી વ્યક્તિગત સુનાવણી કરવાની તક ઊભી થતી નથી . ત્યારળાદ , યોગ્ય ચર્ચા-વિચારણા અને રેકોર્ડ્સ તપાસ્થા પછી , વિલકુલ ડિફોલ્ટર સ્ક્રીનીંગ કમિટીએ સર્વાનુમતે દેવાદાર શ્રી વિમલ ફૂલચંદ ગોચલ

અને શ્રીમતી શારદા ગોચલને ૦૧.૦૭.૨૦૧૫ ના વિલકુલ ડિફોલ્ટર પરના RBI માસ્ટર પરિપત્રના ક્લમ ૨.૧.૩ (c) ના સંદર્ભમાં ભંડોળની સાઇફનિંગ

માટે વિલકુલ ડિફોલ્ટર જાહેર કરતો આદેશ પસાર કર્યો છે. ૦૭.૦૨.૨૦૨૩ ના રોજ યોજાયેલી બેઠકમાં વિલફુલ ડિફોલ્ટર સ્ક્રીનીંગ કમિટીનો આદેશ અને તેનો પ્રતિભાવ

બેંકની NPA મેનેજમેન્ટ પોલિસી ૨૦૨૩-૨૪ ની જેંગવાર્ઇ મુજબ , ૦૭.૦૨.૨૦૨૩ ના રોજ ચોજાચેલી બેઠકમાં વિલકુલ ડિફોલ્ટર રકીનીંગ કમિટીનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો , જે ૧૭.૦૨.૨૦૨૩ ના રોજ શાખા દ્વારા દેવાદારને જણાવવામાં આવ્યો હતો અને તે ડિલિવર થયા વિના પરત કરવામાં આવ્યો હતો, WD ઓર્ડરનું પેપર પ્રકાશન ૧૩.૦૩.૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું. જેના માટે, દેવાદાર તરફથી કોઇ જવાળ/પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું ન હતું . વિલકુવ ડિફોલ્ટર સમીક્ષા સમિતિ - ૧૫.૦૬.૨૦૨૩ ના રોજ બેઠકઃ

વિવર્કુલ ડિફોલ્ટર સ્ક્રીનીંગ કમિટી (WDSC) નો ૦૭.૦૨.૨૦૨૩ ના રોજનો આદેશ સમીક્ષા અને વધુ આદેશો માટે વિવર્કુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિ

ઉપરોક્તે અવલોકનો સ્પષ્ટપણે દશવિ છે કે ૦૧.૦૭.૨૦૧૫ ના રોજ વિલકુલ ડિફોલ્ટર પર RBI માસ્ટર પરિપત્રના કલમ ૨.૧.૩ (c) ના સંદર્ભમાં ડિકોલ્ટર ભંડોળના સાઇકનિંગ માટે જવાબદાર છે. વિલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિએ ૧૫.૦૬.૨૦૨૩ ના રોજ ચોજાચેલી તેની બેઠકમાં સમીક્ષા અને ચર્ચા કરી છે કે લેણદારે પેપર પ્રકાશન દ્વારા જાહ કરવાં છતાં WDSC ના આદેશ સામે જવાબ/પ્રતિનિધિત્વ કર્યું નથી. આમ, વિવકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિએ ૦૭.૦૨.૨૦૨૩ ના WDSC ન

આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં દેવાદારો શ્રી વિમલ ફૂલચંદ ગોચલ અને શ્રીમતી શારદા ગોચલને ૦૧.૦૭.૨૦૧૫ ના વિલફુલ ડિફોલ્ટર પર RBI માસ્ટર પરિપત્ર મુજબ કલમ ૨.૧.૩ (c) ના સંદર્ભમાં ભંડોળની સાઇફનિંગ માટે ડિફોલ્ટર તરીકે વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા . તથ્યો / પુરાવા / ભૌતિક દસ્તાવેર્જોને ધ્યાનમાં લીધા પછી .

ઉપરોક્તને ધ્યાનમાં રાખીને, અમે તમને જણાવીએ છીએ કે વિલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિએ તમને બધાને "વિલકુલ ડિફોલ્ટર" તરીકે વર્ગીકૃત ક્યાં છે.

આમ , બેંક આગામી મહિનાના ૭ દિવસની અંદર RBI/CIC ને તમારી વિગતો જણાવવા માટે આગળ વધશે . स्थण : अमहावाह

વિલકુલ ડિફોલ્ટર સ્ક્રીનિંગ કમિટી (કબ્લ્યુડીએસસી), વતી

#### **RESTILE CERAMICS LIMITED**

Reg office: 204, Sakar Complex, Opp ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat-390015 CIN:L26931GJ1986PLC102350 STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2024
[See Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015]

Sr.		Quarter Ended			Nine Months Ended		Year Ended
No.	Particulars	31-Dec-24	30-Sep-24	31-Dec-23	31-Dec-24	31-Dec-23	31-Mar-24
113-00-700		Unudited	Unudited	Unudited	Unudited	Unudited	Audited
1.	Total Income from Operations	26.85	31.10	35.05	108.48	92.55	113.01
2.	Net Profit/(Loss) for the period (Before Tax and/or Exceptional items)	(24.34)	(25.86)	(11.05)	(73.85)	(62.48)	(91.10)
3.	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(24.34)	(25.86)	(11.05)	(73.85)	(62.48)	(91.10)
4.	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	(24.34)	(25.86)	(11.22)	(73.85)	(62.65)	(91.27)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(24.22)	(25.75)	(11.35)	(73.51)	(62.50)	(90.82)
6.	Equity Share Capital	9827.92	9827.92	9827.92	9827.92	9827.92	9827.92
7.	Other Equity as shown in the Audited Balance Sheet						(12,898.91)
8.	Earnings per share (of Rs. 10/- each) for continuing operations-(not annualised)  1. Basic:  2. Diluted:	(0.02) (0.02)	(0.03) (0.03)	(0.01) (0.01)	(0.07) (0.07)	(0.06) (0.06)	(0.09) (0.09)

The above is an extract of the detailed format of Financial Results Filed with the Stock Exchange under Regulation 33 of SEB (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the Company's web site (www.restile.com)

The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on January, 23, 2025.

Viren Rathod Date: January 23, 2025 **Managing Director** 

### MUTHOOT FINCORP LTD. સોનાનાંદાગીનાહરાજીનોટીસ

Read, Office: Muthoot Centre, TC No 27/ 3022, Punnen Road, Thiruvananthapuram, Kerala, India - 695001... CIN: U65929KL1997PLC011518, Ph: +91 471 4911400, 2331427

31.03.2024 & MSGL, SPL-16, One plus, Guide Prepaid, Super value, ADGL and all other 6 months tenure Gold loans up to 30.06.2024 and MSGB, SME varna & EMI due up to 31.12.2024 સુધીના સમયગાળા માટે કંપનીની નીચે દર્શાવેલ શાખાઓ સાથે જેમણે સોનાના દાગીના ગીરવે મૂકેલ हોય તે તમામની જાણ માટે નોટિસ આપવામાં આવે છે કે ગીરોમુક્તિ માટે આ સમયગાળો પૂર્ણ થઇ ગયો છે અને વારંવાર નોટિસો આપવા છતાં હજુ તેને ગીરોમુક્ત કરાવવામાં આવ્યાં નથી, તારીખ 14.02.2025 ના રોજ સવારે 10 વાગ્યાથી આ દાગીનાઓની દરાજી કરવામાં આવશે

AHMEDABAD-RELIEF ROAD: 3171000106, 317100039, 317100050, 317100055, 317100058, 317100060, 317100066, 317100070, 317100076 BAPUNAGAR-GUJARAT: 259900311, 259900313, 259900315, 259900343, 259900352, 259900373, 259900389, 259900401, 259900402, 259900415 9900421, 259900439, 259900446, 259900469, 259900488, 259900494, 259900500, F7787, F7808. BAVLA: 258700055, 2587000568, 2587000574 2587000581, 2587000595, 2587000596, 2587000603, 2587000608, 2587000618, 2587000637, 2587000638, 2587000645, 2587000646, 2587000661 2587000664, 2587000665, 2587000667, 2587000683, 2587000696, 2587000697, 2587000699, 2587000702, 2587000729, 2587000733, 258700075 2587000750, 2587000782, 258700082, 258700091, 258700114, 258700118, 258700119, 258700132, 258700136, 258700138, 258700139, 258700144 258700147, 258700149, 258700150, 258700154, 258700157, 258700161, 258700163, 258700166, 258700171, 258700174, 258700182, 258700188 258700205, 258700210, 258700212, 258700223, 258700229, 258700236, 258700252, 258700261, 258700266, 258700270, 258700274, 258700287 258700290. BOPAL-AHMEDABAD: 2640000480, 2640000489, 2640000500, 2640000512, 2640000528, 2640000555, 264000091, 264000102 84000106, 264000140, 264000141, 264000150, 264000152, 264000154, 264000160, 264000162, 264000163, 264000167, 264000170, 264000173 64000181, 264000188, 264000190, 264000194, 264000199, 264000204, 264000213, 264000215, 264000217, 264000222, 264000236, CHANDKHEDA 096000059, 1096000118, 1096000160, 1096000611, 1096000615, 1096000618, 1096000623, 1096000625, 1096000629, 1096000630, 1096000634 1096000644, 1096000656, 1096000659, 1096000669, 1096000671, 1096000684, 109600132, 109600135, 109600151, 109600165, 109600172, 109600180 109600181, 109600189, 109600190, 109600200, 109600202, 109600211, 109600214, 109600217, 109600218, 109600236, 109600231, 109600238 109600242, 109600243, 109600244, 109600249, 109600253, 109600259, 109600263, 109600265, 109600270, 109600274, 109600279, 109600283 9600284, 109600288, 109600291, 109600292, 109600295, 109600298, 109600311, 109600320, 109600327, 109600338, 109600351, F13823 F13828, F13835, F13980, F14116. **K.K.NAGAR-AHMEDABAD:** 209700252, 209700263, 209700285, 209700291, 209700310, 209700317, 209700331 209700332, 209700333, 209700377, 209700378, 209700380, 209700398, 209700399, 209700413, 209700415, 209700422, 209700455, 209700456 F7435. MANINAGAR: 1255000248, 1255000253, 1255000258, 1255000259, 1255000265, 125500108, 125500119, 125500126, 125500127, 125500130 125500137, 125500142, 125500148, 125500155, 125500176, MOTERA: 247700275, 247700278, 247700290, 247700297, 247700318, 24770023 247700331, 247700339, 247700344, 247700346, 247700362, 247700364, 247700375, 247700382, 247700384, 247700397, 247700405, 247700408 247700410, 247700415, 247700422, 247700423, 247700433, 247700438, 247700452, 247700463, 247700465, 247700467, 247700468, F6527, F6784 F6823. NARANPUR: 1297000291, 1297000328, 129700126, 129700127, 129700131, 129700134, 129700145, 129700150, 129700154, 129700156 129700157, 129700164, 129700165, 129700178, 129700182, 129700183, 129700188, 129700193, 129700197, 129700211, 129700221, 129700224 129700227, 129700234, NARODA: 210400304, 210400317, 210400331, 210400369, 210400370, 210400376, 210400396, 210400401, 210400450 210400452, 210400463, 210400494. NIKOL: 2657000401, 2657000411, 2657000419, 2657000421, 2657000448, 2657000455, 265700152, 265700164 265700178, 265700192, 265700202, 265700204, 265700209, 265700222, 265700225, 265700230, 265700256, 265700262, 265700264, 265700273 265700274, 265700282, 265700284, 265700285, 265700291, 265700303, 265700310, 265700311, 265700314, 265700321, 265700323, 265700327 65700328, 265700331, 265700333, F10049, F9910. ODHAV: 0974000365, 0974000373, 0974000375, 0974000384, 0974000385, 097400082, 097400087 097400097, 097400110, 097400128, 097400129, 097400137, 097400144, 097400157, 097400161, 097400163, 097400169, 097400170, 09740017 097400176, 097400179, 097400185, 097400186, 097400193, 097400204, 097400218, 097400219, 097400220, 097400222, 097400226, 097400236 F11424, F9557, PALDI: 1192000192, 1192000196, 1192000226, 119200083, 119200135, 119200137, SANAND-AHMEDABAD: 2488000001, 2488000012 188000020, 2488000025, 248800440, 248800749, 248800766, 248800769, 248800770, 248800802, 248800814, 248800819, 248800828, 24880085 48800860, 248800881, 248800889, 248800893, 248800894, 248800896, 248800900, 248800909, 248800913, 248800923, 248800945, 24880095 248800976, 248800982, 248800987, 248800989, 248800990, 24880997, 248801000, 248801002, 248801009, 248801011, 248801012, 248801025 248801127, 248801141, 248801145, 248801147, 248801150, 248801162, 248801169, 248801183, 248801191, 248801195, 248801213, 248801221 48801222, 248801223, 248801227, 248801228, 248801233, 248801235.

ાંલગ્ન શાખાઓ પર હરાજી કરવામાં આવશે. કૃપા કરી ધ્યાન રાખો કે કોઇ કારશોસર હરાજી તે જ દિવસે પૂર્ણન થાય તો, તેની પુનઃ હરાજી તારીખ 25.02.2025 ના રોજ સવારે 10 વાગ્યે આ સરનામે કરવામાં આવશે Muthoot FinCorp Ltd., Ground Floor, Orange Mall, 28, 29, Ahmedabad Mehsana High Way, Near Sharda Petrol Pump, Chandkheda, Gujarat-382424. <sup>\*</sup>બોલી બોલનારાંને ફોટો આઇડી કાર્ડ, પાન કાર્ડ સાથે લાવવા વિનંતી. સફળ બોલી બોલનારે સ્તવક માસ્ફેત નાણાં ટ્રન્સફર કરવા પડશે. **Muthoot FinCorp Ltd** 

#### **EAAA India Alternatives Limited**

(Formerly known as Edelweiss Alternative Asset Advisors Limited)

Corporate Identity Number: U67190MH2008PLC182205 Registered Office: Edelweiss House, Off. CST Road, Kalina, Mumbai - 400 098

Statement of Financial results for the quarter ended December 31, 2024

		Quarte	r Ended	Year Ende	
	Particulars	December 31, 2024 (Unaudited)	December 31, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)	
1	Total income from operations	15,793.54	9,651.40	40,937.07	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4,762.05	4,591.40	14,724.84	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	4,762.05	4,591.40	14,724.84	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3,999.78	3,478.90	11,121.47	
5	Total Comprehensive Income for the period	4,003.89	3,480.18	11,125.92	
6	Paid up Equity Share Capital (Face Value of ₹ 5/- Per Share)	3,214.01	1,237.47	1,884.53	
7	Instruments entirely equity in nature	-	34,000.00	23,000.00	
8	Reserves (excluding Revaluation Reserves)	70,124.08	20,035.26	32,866.01	
9	Securities Premium Account	33,214.58	1,191.12	11,544.06	
10	Net worth <sup>1</sup>	73,338.09	55,272.74	57,750.54	
11	Paid up Debt Capital / Outstanding Debt	42,363.09	41,976.03	44,482.87	
12	Outstanding Redeemable Preference Shares	-	-	-	
13	Debt Equity Ratio	0.58	0.76	0.77	
14	Earnings Per Share ( Face Value of ₹ 5 each)				
	- Basic (Not annualised for the quarter)	6.22	5.41	17.30	
	- Diluted (Not annualised for the quarter)	6.22	5.41	17.30	
15	Capital Redemption Reserve	-	-	-	
16	Debenture Redemption Reserve	1,667.18	2,126.14	2,264.21	
17	Debt Service Coverage Ratio (DSCR) $^{2}$ (Not annualised for the quarter)	2.21	6.26	2.17	
18	Interest Service Coverage Ratio (ISCR) <sup>3</sup> (Not annualised for the quarter)	5.00	6.26	5.42	

DSCR = Profit before interest and tax / (Interest expense + Principal repayment in next six months) ISCR = Profit before interest and tax / Interest expense

The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges in accordance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended (the 'Listing Regulations, 2015') and the Accounting Standards specified under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and the relevant provision of the Companies Act, 2013, as applicable. The full format of the quarterly financial results are available on the website of the Stock exchange (www.bseindia.com) and the Company's website -

For the other line items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, the pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on the Company's website - www.eaaa.in.

The above financial results of EAAA India Alternatives Limited (formerly known as Edelweiss Alternative Asset Advisors Limited) ('the Company') for the nine months ended December 31, 2024 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on

Figures for the previous quarter have been regrouped/reclassified wherever necessary to conform to current quarter presentation.

DIN.: 00008509

On behalf of the Board of Directors **EAAA India Alternatives Limited** (formerly known as Edelweiss Alternative Asset Advisors Limited)

Venkatchalam Ramaswamy Managing Director & Chief Executive Officer

Mumbai, January 22, 2025.